



ફેમિલી ડે 2022 ઈન બ્રેમ્પટન (બ્રેમ્પટનમાં કુટુંબ દિવસ 2022)

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જૂન 23, 2022) – આ વર્ષે, કેનેડા ડે શુક્રવાર, જુલાઈ 1 નાં રોજ આવશે.

સમુદાયને ટેકો આપવા અગ્નિશમન અને કટોકટીની સેવાઓ, ટ્રાફિક સેવાઓ, કાયદાકીય અમલ બજાવણી, રોડ ઓપરેશન્સ અને સુરક્ષા સેવાઓ સહિતની તમામ અનિવાર્ય અને નિર્ણાયક સેવાઓનું સંચાલન રાખેતા મુજબ ચાલુ રહેશે.

રહેવાસીઓ કોઈ પૂછપરછો માટે 311 અથવા (બ્રેમ્પટન બહારથી) 905.874.2000 નંબર પર ફોન કોલ કરી શકે છે, Brampton 311 એપનો ઉપયોગ કરી શકે છે (App Store અથવા Google Play પર ઉપલબ્ધ) અથવા વેબસાઈટ www.311brampton.ca જોઈ શકે છે અથવા ઈમેઈલ સરનામું 311@brampton.ca ને ઈમેઈલ મોકલી શકે છે. અમે સીટી ઓફ બ્રેમ્પટન કે રીજયન ઓફ પીલને સંબંધિત કોઈપણ બાબતો માટે 24/7 ઉપલબ્ધ રહીએ છીએ.

ઉજવો કેનેડા ડે 2022

સીટી ઓફ બ્રેમ્પટન જુલાઈ 1 નાં રોજ બપોરે 12 થી રાત્રે 10 વાગ્યા સુધી કેનેડા ડે નિમિત્તે ઉજવણી ફરીથી થિંગકુસી પાર્કમાં રૂબરૂમાં કરવાની ઘોષણા કરવામાં ખુશી અનુભવે છે. બ્રેમ્પટનની કેનેડા ડે ઉજવણી શહેરનો સૌથી મોટો એક દિવસીય પ્રસંગ છે, આ પ્રસંગની ઉજવણી જીવંત મનોરંજન, કળા, સંસ્કૃતિ, ખોરાક, ફટાકડાં અને ઘણું બધું સાથે દિવસભર ઉજવવાનો પ્રસંગ બની રહે છે!

કેનેડા ડે આયોજન પર વધુ માહિતી માટે વેબસાઈટ જુઓ, www.brampton.ca/canadaday.

આતશબાજી સુરક્ષા

કેનેડા ડે વર્ષમાં ચાર મંજૂર કરેલા દિવસોમાંનો એક છે જ્યારે બ્રેમ્પટનમાં પરમીટ લેવાની જરૂરિયાત ઊભી થયા વગર ખાનગી મિલકત પર ટૂંકા-અંતરના ફટાકડાં ફોડવાની છૂટ આપવામાં આવે છે. બાય-લો (પેટા-કાનૂન) હેઠળ, આતશબાજીની પરવાનગી વિક્ટોરિયા ડે, દિવાળી અને નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ પણ આપવામાં આવે છે.

ટૂંકા-અંતરના ફટાકડાઓ એ છે જે ત્રણ મીટર (10 ફૂટ) કરતા ઓછું અંતર કાપતા હોય છે જ્યારે તે છોડવામાં આવે (દા.ત. ફાઉન્ટેઈન્સ, વ્હીલ્સ, ગ્રાઉન્ડ સ્પિનર્સ, સ્પાર્કલર્સ). જેની ઊંચાઈ અંદાજે બ્રેમ્પટન ટ્રાન્ઝિટ બસ કે બાસ્કેટ બોલના હૂપ જેટલી હોય.

બ્રેમ્પટનમાં રોકેટ જેવા અન્ય તમામ ફટાકડાં ફોડવાની મનાઈ છે. આ શહેર રહેવાસીઓને યાદ અપાવે છે કે ફટાકડાઓ સ્ટ્રીટ, સાઈડવોક્સ પર, શહેરના પાર્ક્સ કે મ્યુનિસિપલ અથવા સ્કૂલ મિલકતોમાં ફોડવાની પરવાનગી નથી.

ખાનગી મિલકતમાં ટૂંકા-અંતરના ફટાકડાઓ ઉપયોગમાં લેતી વખતે, રહેવાસીઓએ આ સુરક્ષા સાવચેતીઓ અચૂક અનુસરવી રહી:

- પોતાની પાસે ફટાકડાં હોલવવા પાણી ભરેલું પાત્ર અથવા પાણી ભરેલી હોઝ લાઈન ઉપલબ્ધ રાખો.
- તમારા હાથમાં સ્પાર્કલર સિવાયના ફટાકડાં ક્યારેય ફોડશો નહિ કે પકડી રાખશો નહીં.



- અન્ય લોકો પર ફટાકડાં ક્યારેય ફેંકશો નહિ કે તેઓ તરફ ચિંધશો નહીં.
- સ્પાર્કલર્સનો ઉપયોગ કર્યો પછી, તેનો નિકાલ કરતા પહેલાં તેને પૂરેપૂરા ઠંડા પાડવા પાણીના પાત્રમાં રાખો.
- બધાં ફટાકડાનો નિકાલ કરતા પહેલાં તેને પૂરેપૂરા ઠંડા થવા દો.

દર વર્ષે, ફટાકડાં વિક્રેતાઓ ફટાકડા વેચવાનું લાઇસન્સ મેળવે ત્યાર પહેલાં તેઓએ સીટીની તાલીમ લેવી અનિવાર્ય છે. સીટીએ વિક્રેતાઓને ઓનલાઇન તાલીમ આપવાની તૈયારી બતાવી. કેનેડા કે માટે નવા ફાયરવર્ક્સ લાઇસન્સીસ આપવામાં આવ્યા નથી. જો રહેવાસીઓ સ્ટોર્સમાં કે બ્રેમ્પટનમાં બીજા ક્યાંય ફટાકડાં વેચાતા હોવાનું જુએ તો, સર્વિસ બ્રેમ્પટનને તે બાબત 311 અથવા (બ્રેમ્પટન બહારથી) 905.874.2000 નંબર પર કોલ કરીને જણાવવાનું કહેવામાં આવે છે.

ફટાકડાથી સુરક્ષા અને બાય-લોઝ (પેટા-કાનૂનો) વિશે વધુ માહિતી મેળવવા વેબસાઇટ જુઓ, www.brampton.ca/fireworks.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ

કેનેડા કે પર બ્રેમ્પટન ટ્રાન્ઝિટ રવિવાર/રજાના દિવસના સમયપત્રક પ્રમાણે ચાલુ રહેશે. ટર્મિનલ્સ પર ગ્રાહક સેવા કાઉન્ટર્સ બંધ કરવામાં આવ્યા છે. સંપર્ક કેન્દ્ર ઉતારુઓને સહાયરૂપ થવા સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી ઉપલબ્ધ છે.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ ચિંગકુસી પાર્ક પર કેનેડા કે ઉજવાણી નિમિત્તે બપોરે 12 થી રાત્રે 10:30 વાગ્યા સુધી અવરજવર માટે મફત શટલ બસ સેવાઓ પૂરી પાડશે! નીચેના ચાર પૈકી એક સ્થળેથી મફત શટલ બસ સેવાનો લાભ મેળવો:

- માઉન્ટ પ્લીઝન્ટ ગો સ્ટેશન
- ટ્રિનિટી કોમન મોલ
- શેરિડેન કોલેજ
- ગૌર મેડોસ કમ્યુનિટી સેન્ટર

રૂટ અને સમયપત્રક માહિતી માટે, 905.874.2999 નંબર પર ફોન કોલ કરો અથવા વેબસાઇટ જુઓ, www.bramptontransit.com.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટની બસોમાં અને બ્રેમ્પટન ટ્રાન્ઝિટના ટર્મિનલ્સ પર મારસ્ક પહેરવા વૈકલ્પિક છે. મારસ્ક પહેરવાનું ચાલુ રાખનાર અને તેવું ન કરવાનું પસંદ કરતી વ્યક્તિ સાથે આદરપૂર્વક વર્તન રાખો.

સર્વિસ અઘતન માહિતી માટે વેબસાઇટ www.bramptontransit.com જુઓ અથવા Twitter પર [@bramptontransit](https://twitter.com/bramptontransit) ને અનુસરો. કોઈ પ્રશ્નો સીધા બ્રેમ્પટન ટ્રાન્ઝિટના સંપર્ક કેન્દ્રને 905.874.2999 નંબર પર પૂછી શકાય છે.

બ્રેમ્પટન પાર્ક્સ

કેનેડા કે પર, બ્રેમ્પટનમાં લીશ-ફી ડોગ પાર્ક્સ સહિત, બધી મનોરંજનલક્ષી ટ્રેઇલ્સ (પગદંડીઓ), પ્લેગ્રાઉન્ડ્સ, અને પાર્ક્સ ખુલ્લા રહે છે. શારીરિક પ્રવૃત્તિ ટ્રેક વ્યક્તિનું આરોગ્ય અને સુખાકારી માટે મહત્વની હોય છે! આપણાં પાર્ક્સ અને રિક્રિએશનલ ટ્રેઇલ્સ શોધવા વેબસાઇટ જુઓ, www.brampton.ca/parks.

બ્રેમ્પટન રિક્રિએશન

બ્રેમ્પટન રિક્રિએશન સેન્ટર્સ કેનેડા કે પર સંચાલનના સુધારેલા કલાકો પ્રમાણે ખુલ્લા રહેશે. રજાના દિવસોના કલાકો [અહીં](#) જોઈ શકાય છે.



વેબસાઈટ www.brampton.ca/summerfun જોઈને ટેનિસ અને પિકલબોલ કોર્ટ્સ, સ્પેશ પેડ્સ અને રિક્રિએશનલ ટ્રેઈલ્સ સહિતની, વિવિધ આઉટડોર સવલતો પર વધુ માહિતી મેળવો.

વેબસાઈટ www.brampton.ca/recreation જોઈને રિક્રિએશન સેન્ટર્સ, ઉપલબ્ધ કાર્યક્રમો, સભ્યપદો અને વધુ માહિતી મેળવો.

બ્રેમ્પટન લાઈબ્રેરી

કેનેડા ડે નિમિત્તે બ્રેમ્પટન લાઈબ્રેરીની બંધી શાખાઓ બંધ રહેશે. જુલાઈ 3, 2022 થી અમલી, બંધી શાખાઓ દર રવિવારે બંધ રહેશે.

અમારી સાથે વેબસાઈટ www.bramptonlibrary.ca પર ઓનલાઈન જોડાઈને ઈ-બુક્સ અને ઓડિયોબુક્સ, સ્ટ્રીમ ટેલીવિઝન અને મૂવીસ ઉછીની લો, વિવિધ શ્રેણીના શૈક્ષણિક, રચનાત્મક, અને વ્યાવસાયિક ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ્સ, અને ઘણી વસ્તુઓ સુધી પહોંચ મેળવો. અમારા [આયોજનોના કેલેન્ડર](#) મારફતે બંધી ઉંમરના લોકો અને હિતો માટે વર્ચ્યુઅલ, બ્રાંચમાં અને ડ્રોપ-ઇન કાર્યક્રમો માટે નોંધણી કરાવો અને ઈમેઈલથી અમારી અદ્યતન માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો. અમને [Facebook](#), [Twitter](#), [Instagram](#), અને [LinkedIn](#), પર અનુસરો અને iOS અને ગૂગલ પ્લે પર બ્રેમ્પટન લાઈબ્રેરી મોબાઈલ એપ ચોક્કસ ડાઉનલોડ કરો. [અમારી એપ વિશે વધુ વિગતો માટે અહીં ક્લિક કરો.](#) અમારા કર્મચારીઓ સાથે લાઈવ ચેટ કરવા, કોઈ પ્રશ્ન પૂછવા, અમારી વેબસાઈટ જુઓ.

બ્રેમ્પટન એનિમલ સર્વિસીસ

કેનેડા ડે નિમિત્તે બ્રેમ્પટન એનિમલ શેલ્ટર બંધ રહેશે. એનિમલ કંટ્રોલ સવારે 8 થી સાંજે 6:30 વાગ્યા સુધી રસ્તા પર રહેશે અને આ સમય સિવાયના ક્લાકોમાં કટોકટીના કોલ્સને પ્રતિભાવ આપવાનું ચાલુ રાખશે.

-30-

મીડિયા સંપર્ક (MEDIA CONTACT)

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટીકલ્ચરલ મીડિયા

multiculturalmedia@brampton.ca